

ધાડના આરોપીઓને ગણત્રીના દિવસોમાં પકડી પાડતી, સુરત શહેર વરાછા પોલીસ

સુરત શહેરના વરાછા પો.સ્ટે. વિસ્તારમાં આ કામના ફરીયાદી મુકેશભાઈ જવાહરજી પુરોહિત ઉ.વ.૪૯ ધંધો-વેપાર રહે. મ.નં.૧૧, કૈલાશ બંગ્લોઝ નેમીનાથનગરની બાજુમાં પર્વત પાટીયા, સુરત તથા સાહેદો મકનારામ પ્રતાપજી પુરોહિત તથા પ્રકાશ જવાહરજી પુરોહિતનાઓ ગઈ તા.૧૦/૦૨/૨૦૨૦ અશ્વનીકુમાર ગરનાળા પાસે આવેલ તાપી નદી ઉપર આવેલ રેલ્વેના લોખંડના બ્રીજ ઉપરથી તાપી નદીમાં કુલ પધરાવવા માટે ગયેલ તે દરમ્યાન આઠ અજાણ્ય ઈસમો જેના પુરા નામઠામની ખબર નથી તેઓએ ફરીયાદીશ્રી તથા સાહેદોને ઢીકક મુક્કીનો માર મારી અને ફરીયાદીના ખીસ્સામાં રહેલ રોકડા ૨૦,૦૦૦/- તથા વિવો કંપની મોબાઈલ ફોન જેની કિંમત આશરે ૫૦૦૦/- તથા સાહેદ મકનારામ નાઓના ખીસ્સામાં રાખેલ સેમસંગ કંપનીનો જે-૭ મોબાઈલ ફોન જેની આશરે ૩૦૦૦/- તથા સાહેદ પ્રકાશભાઈ જવાહરજી પુરોહિતના ખીસ્સામાં રહેલ રેડમી MI 7 પ્રો મોડલનો મોબાઈલ ફોન જેની કિંમત આશરે ૧૦,૦૦૦/- મળી કુલ મોબાઈલ ફોન નંગ-૦૩ તથા રોકડા રૂપિયા ૨૦,૦૦૦/- મળી કુલ રૂપિયા- ૩૮,૦૦૦/-ની મતાનો મુદ્દામાલ બળજબરીથી કાઢી લઈ લુંટ કરી ગુનો કરેલ હોય જે બાબતે વરાછા પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૨૧૦૦૬૦૨૦૦૩૧૮/૨૦૨૦ ઈ.પી.કો. ક્લમ-૩૯૫, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ મુજબનો ગુનો નોંધાયેલ હતો. સદર ગુનાના આરોપીઓને શોધી કાઢવા સાડ પો.સ્ટે.ના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સાથેના અ.હે.કો. દિવ્યેશભાઈ હરીશભાઈ બ.નં.૧૩૮ તથા અ.પો.કો. પ્રતાપસિંહ વિજુભા બ.નં.૬૩૬ તથા અ.પો.કો. સંજયભાઈ હિકુભાઈ બ.નં.૧૭૫ તથા અ.પો.કો. ચંદ્રદિપસિંહ મહેન્દ્રસિંહ બ.નં.૨૨૧૪ નાઓની બાતમી હકિકત મળેલ કે ધાડ પાડનાર ઈસમોમાંથી ત્રણ ઈસમો અશોકનગર ઝુપડપટ્ટી પાસે ઉભેલ છે. વિગેરે બાતમી હકિકત આધારે વરાછા અશોકનગર ઝુપડપટ્ટી પાસેથી આરોપીઓ (૧) ગણેશ બાંછાનીધી કન્હાર ઉ.વ.૨૬ રહે.ઘર નં.૫૦, ગૌતમનગર ઝુપડપટ્ટી જુની જી.આઈ.ડી.સી. પાસે કતારગામ, સુરત મુળવતન-નીમીનાગામ, થાના-કોદલા, જી.ગંજમ (ઓરીસ્સા) તથા (૨) નિલુ બુધીયા ગૌડ ઉ.વ.૨૪ રહે.ઘર નં.૫૦, ગૌતમનગર ઝુપડપટ્ટી જુની જી.આઈ.ડી.સી. પાસે કતારગામ, સુરત મુળવતન- ફાસી, થાના-કોદલા, તા.બેજુનાપડા જી.ગંજમ (ઓરીસ્સા) તથા (૩) બાલકિશન કપ્તાન રાઠોર ઉ.વ.૩૦ રહે.કુલ માર્કેટ બ્રીજની નીચે એ.કે.રોડ શૌચાલય પાસે વરાછા, સુરત. મુળવતન-મ.નં. ૧૬, હાઠમેદાન પાસે રાઠોર મહોલ્લા રાજખેડા થાના-રાજખેડા, જી.ધોલપુર (રાજસ્થાન) નાઓને પકડી પાડી ગુનાના કામે પુછપરછ કરતા ગુનાની કબુલાત કરતા હોય જે ઉપરોક્ત વણશોધાયેલ ગુનો શોધી કાઢી પ્રસંશનીય કામગીરી કરવામાં આવેલ છે.

શોધી કાઢેલ ગુના:- (૧) વરાછા પો.સ્ટે. ૧૧૨૧૦૦૬૦૨૦૦૩૧૮/૨૦૨૦ ઈ.પી.કો. ક્લમ-૩૯૫, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ મુજબ.